



Gujarat Public Service Commission

Corrigendum

List of Eligible Candidates for Interview

Advertisement No. 91/2018-19

વંચાણે લીધી: (1) આયોગની તા:04.02.2020ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી.

(2) આયોગની તા:19.02.2021ની રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદી.

1. સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજો ખાતે અર્થશાસ્ત્ર વિષયના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-2 ની જગ્યાએ ભરતી કરવા માટે જા.ક. 91/2018-19 સંદર્ભે તા.08.09.2019ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે આયોગની ઉપર ક્રમ : (2) પર વંચાણે લીધેલ યાદીથી રૂબરૂ મુલાકાતને પાત્ર કુલ: 90 ઉમેદવારોના બેઠક નંબરોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
2. આયોગની ઉપર ક્રમ : (2) પર વંચાણે લીધેલ યાદીથી, બેઠક ક્રમાંક: 101000359 ને "આયોગે રૂબરૂ મુલાકાત માટે નિયત કરેલ લાયકી ધોરણ ધરાવે છે, પરંતુ, જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરતા ન હોય રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા નથી" ની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. શિક્ષણ વિભાગે તા:27.05.2021ના પત્રથી કરેલ સ્પષ્ટતા મુજબ, OH પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારને પ્રસ્તુત જાહેરાત માટે પાત્ર ગણવાના થાય છે. આથી, બેઠક ક્રમાંક: 101000359 નો રૂબરૂ મુલાકાત માટે નિયત કરેલ લાયકી ધોરણમાં સમાવેશ થતો હોય, તેઓને રૂબરૂ મુલાકાત માટે પાત્ર જાહેર કરવામાં આવે છે.
3. ઉક્ત ઉમેદવાર રૂબરૂ મુલાકાત માટે પાત્ર જાહેર થવાથી, આયોગના તા:14.10.86ના કચેરી હુકમથી નિયત થયેલ નોર્મ્સ મુજબ, બિન અનામત (કોમન)કેટેગરીની 07 જગ્યા સામે રૂબરૂ મુલાકાત માટે જરૂરી 21 ઉમેદવારો મળી રહેતા હોય, બિન અનામત (કોમન) કેટેગરીના રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારો પૈકી, મેરીટ મુજબ છેલ્લા ઉમેદવાર બેઠક ક્રમાંક: 101000384 ને હવે રૂબરૂ મુલાકાત માટે અપાત્ર જાહેર કરવામાં આવે છે તથા તેઓને " જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરે છે, પરંતુ આયોગે રૂબરૂ મુલાકાત માટે નિયત કરેલ લાયકી ધોરણ ધરાવતા ન હોય, રૂબરૂ મુલાકાતને પાત્ર થતા નથી." ની યાદીમાં સમાવેશ કરવામાં આવે છે.

4. ઉક્ત વિગતે , આયોગની ઉપર ક્રમ :(2) પર વંચાણે લીધેલ યાદીથી પ્રસિધ્ધ કરવામાં આવેલ યાદીના ફકરા-૩માં દર્શાવેલ ઉમેદવારોની સંખ્યા ૦૭ થાય છે તથા ફકરા-૪ માં દર્શાવેલ ઉમેદવારોની સંખ્યા ૦૯ થાય છે.
5. આયોગની ઉપર ક્રમ :(2) પર વંચાણે લીધેલ યાદીથી પ્રસિધ્ધ કરવામાં આવેલ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદીની અન્ય વિગતો યથાવત રહે છે.

સ્થળ: ગાંધીનગર-૩૮૨૦૧૦
તારીખ: ૨૨.૦૬.૨૦૨૧

સંયુક્ત સચિવ
ગુજરાત જાહેર સેવા આયોગ